

LL.B. Semester - 1 (CBCS) Examination
Oct/Nov-2025 (As Per Syllabus Year July - 2022)
Law of Torts (Core)

Time: 3:00 Hours**Marks:100****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	“દરેક દુષ્કાર્ય એ કોઈ અપકૃત્ય નથી”.- આ નિવેદનની સંબંધિત કેસ -લો સાથે ચર્ચા કરો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન-૧	અપકૃત્ય વિષે સમજાવો. અપકૃત્યના ઉદ્ભવ, ખ્યાલ અને હેતુઓની ચર્ચા કરો.	
પ્રશ્ન-૨	બદનક્ષી અને અંગત સંબંધને લગતા અપકૃત્યની ચર્ચા કરો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન-૨	“હાનિ વગરનું નુકશાન” અને “નુકશાન વગરની હાનિ”-વચ્ચેનો તફાવત સમજાવો.	
પ્રશ્ન-૩	ગ્રાહકને વ્યાખ્યાયિત કરો, ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ગ્રાહકને મળતા અધિકારોની ચર્ચા કરો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન-૩	ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ જિલ્લા ફોરમના બંધારણ અને કાર્યોની ચર્ચા કરો.	
પ્રશ્ન-૪	મોટર વ્હીકલ એક્ટ હેઠળ “મૃત્યુ” અને “કાયમી અપંગતા” માટે વળતર સંબંધિત જોગવાઈની ચર્ચા કરો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન-૪	મોટર વ્હીકલ એક્ટ હેઠળ “હિટ અને રન” અકસ્માતો માટેની વિશેષ જોગવાઈઓની ચર્ચા કરો.	
પ્રશ્ન-૫	ટ્રેકનોંધ લખો: (કોઈપણ બે)	(૨૦)
	1) ઉપદ્રવ.	
	2) ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ સેવા અને ફરિયાદ.	
	3) સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત.	
	4) ત્રાહિત પક્ષના જોખમ સામે વીમાની જોગવાઈઓ.	

ENGLISH VERSION

Que.1	“Every wrong is not a Tort”.- discuss this statement with case laws.	(20)
	OR	
Que.1	Explain about the Tort. Discuss the nature, scope and objects of Tort.	
Que.2	Discuss the Torts related to Defamation and Personal relation.	(20)
	OR	
Que.2	Explain the distinguished between “Injuria sine Damnum” and “Damnum sine injuria”.	
Que.3	Define the Consumer, discuss the rights available to consumer under consumer protection Act.	(20)
	OR	
Que.3	Discuss the constitution and functions of District Forum under the consumer protection Act.	
Que.4	Discuss the provision regarding compensation for “Death” and “Permanent Disability” in under the Motor Vehicle Act.	(20)
	OR	
Que.4	Discuss the special provisions for Hit- and -Run accidents under the motor vehicles Act.	
Que.5	Write Short note: (Any Two)	(20)
	1) Nuisance.	
	2) Service and complaint under the consumer protection Act.	
	3) Doctrine of Absolute Liability.	
	4) provisions of Insurance against third party risk.	
